

BHATIA COMMUNICATIONS & RETAIL (INDIA) LIMITED

BHATIA'S[®]
The mobile one stop shop

CIN: L32109GJ2008PLC053336

Regd Off: 132, Dr. Ambedkar Shopping Centre, Ring Road, Surat-395002
Email: info@bhatiamobile.com, Ph: 0261-2349892
Website : www.bhatiamobile.com

Date: 15/11/2022

To,
BSE LIMITED
Phiroze Jeejeebhoy towers,
Dalal Street,
Mumbai- 400 001.

Script Code : BHATIA/540956

Subject : Intimation of Newspaper Advertisement of Extract of standalone unaudited financial results for the Quarter Ended 30th September, 2022

Reference No. : Regulation 47 and 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Dear Sir/Madam,

We wish to inform that pursuant to Regulation 47 and 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copies of Extract of Unaudited Financial Result for the Quarter ended on 30th September, 2022 published in Newspapers on Tuesday, 15th November, 2022

1. English Daily: "Free Press Gujarat" dated 15th November, 2022
2. Regional Language Daily: "Lokmitra" dated 15th November, 2022

You are requested to kindly take the same on record.

Yours Faithfully,
Thanking you

For Bhatia Communications & Retail (India) Limited


Sanjeev Harbanslal Bhatia
Managing Director
DIN: 02063671



Place: Surat

Encl: Copy of Newspaper

How Miyake was the first global ambassador of khadi and Make in India

Many may not have known that Japanese avant-garde designer Issey Miyake loved India's textile heritage and was fascinated by khadi. He was completely taken in by its simplicity and purity, a minimalist philosophy that echoed his own and its light and airy quality. Not only that, he had a backdrop production hubs in and around Ahmedabad. Recalls Fashion Design Council of India (FDCI) Chief Sunil Sethi, "I remember visiting one of my vendors in the city way back in 2004 and finding that a lot of apparel for Issey Miyake was being produced there by our craftspeople. I felt proud that his fineness was being crafted here. He has got to be one of our earliest international ambassadors of khadi, even before we woke up to the fabric's many possibilities."

In fact, in 2019, Miyake held an exhibition on khadi at the Tribeca store in New York, titled, "Khadi: Indian Craftsmanship." The connection deepened following his interactions with textile revivalist Martand Singh. In fact, Makiko Minagawa, who was earlier the textile director of the Miyake Design Studio, had worked with Martand Singh and Asha Sarabhai in creating a natural and simple line called ASHA. Minagawa later became the creative director of HaAT, a line produced by Miyake and named after our concept of a village market. She was greatly influenced by Martand Singh. "In fact, when Singh passed away, Miyake organised a homage and a khadi exhibit in Kyoto, too," adds Sethi.

While Sethi had a ringside view of Miyake's store in Hong Kong that Chauhan realised why Miyake spoke a global language. "I was amazed by how an entire range could be created by pleats, proof that minimalism was not just about limiting yourself but expanding possibilities. He used style in a very funky and classy way. It has a timeless feel. That's why he appealed to both the old and youth, breaking the elitism of high fashion and venturing into streetwear. The Bao bao bags with resin

it with his creativity. In the 1980s, he was celebrated for using materials ranging from plastic to metal and paper.

By 1995, Miyake had developed a new way of pleating fabric, wrapping it in between layers of paper and applying a heat press on them. He ran several tests before he was sure that the pleats stayed in place and didn't wrinkle. That led to his signature "Pleats, Please" line, avant-garde but practical, wearable and timeless. It was distinctive enough to impress a young NIFT student called Samant Chauhan, who chose Miyake for a final year project. "He has greatly influenced my work and I have no shame in admitting that I have picked up the idea of pleats and colour palette from him. I learnt my best lesson in fashion while studying him, that conceiving a simple design is the most complicated work of art. There are many followers of the Japanese philosophy of elegant minimalism but it took Miyake to enlighten Paris and get accepted by fashionists there," says Chauhan, who has internalised black solids as his colour, be it in his wardrobe or his collection. "Little wonder then that Steve Jobs fell for his black turntables. That has been my comfort wear too, for long. I am packing my bags for Mumbai even as I speak and I am seeing only blacks. Come to think of it, he used Black models much before Black Lives Matter became a hashtag. That's how deep his philosophy runs within me, pushing the envelope quietly and consistently," adds Chauhan.

It was while walking through Miyake's store in Hong Kong that Chauhan realised why Miyake spoke a global language. "I was amazed by how an entire range could be created by pleats, proof that minimalism was not just about limiting yourself but expanding possibilities. He used style in a very funky and classy way. It has a timeless feel. That's why he appealed to both the old and youth, breaking the elitism of high fashion and venturing into streetwear. The Bao bao bags with resin

geometric triangles were modish but smartly functional. There's a reason why his perfume, L'Eau D'Issey (1992), was rumoured to sell every 14

seconds. It again is simple, drawn from nature and without a complexity of blends for the sake of human artistry. And much before sustainability

was a conscious choice, his A-POC (A Piece of Clothing) line used a special weaving machine that made outfits out of one continuous tube of fabric.

TEXEL INDUSTRIES LIMITED
Regd. Office: Block No. 2106, Sanyal Khyang Road, W. Shah Alloys Ltd., Vill. Santaj, Tal. Kalol, Dist. Gandhinagar - 382 721, Gujarat, India.
CIN:L21910GJ9899102576; Ph:+91888026229/26110; Email: finance@grovel.com; Website: www.grovel.com

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Half Year ended 30th September, 2022

Sr.No.	Particulars	Consolidated					
		Quarter Ended		Half Year Ended		Year Ended	
		30/09/2022	30/06/2022	30/09/2021	30/09/2022	30/09/2021	31/03/2022
1	Total Income from Operations	2705.29	3125.60	2307.12	5833.50	5083.69	9195.53
2	Net Profit/(Loss) for the period before tax	(191.39)	(175.94)	81.70	(367.33)	182.84	162.23
3	Net Profit/(Loss) for the period after tax	(232.94)	(182.90)	61.98	(415.84)	136.96	115.96
4	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period after tax and other Comprehensive Income (after tax))	6.93	(8.00)	2.28	(14.78)	0.83	(4.43)
5	Paid up Equity Share Capital (Face value of Rs. 10/- each)	833.97	833.97	522.25	833.97	522.25	833.97
6	Other Equity	-	-	-	-	-	2577.25
7	Earnings per equity share (of Rs. 10/- each) (for continuing and discontinued operations - (a) Basic & (b) Diluted)	(2.79)	(2.19)	1.19	(0.50)	2.62	1.84

Additional information on Standalone Financial Results is as follows:

Particulars	Consolidated					
	Quarter Ended		Half Year Ended		Year Ended	
	30/09/2022	30/06/2022	30/09/2021	30/09/2022	30/09/2021	31/03/2022
Income from Operations	2705.29	3125.60	2307.12	5833.50	5083.69	9195.53
Profit Before Tax	(187.78)	(173.42)	84.24	(361.2)	187.93	175.04
Profit After Tax	(210.23)	(180.38)	64.52	(390.53)	143.09	128.79
Total Comprehensive Income (After Tax)	6.97	(8.87)	1.85	(12.9)	3.7	(3.48)

The above is an extract of the detailed format of the Unaudited Standalone & Consolidated Financial Results for the quarter and half year ended 30th September, 2022 filed with Bombay Stock Exchange ("BSE") under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Standalone & Consolidated Financial Results for the quarter and half year ended 30th September, 2022 is available on the BSE website i.e. www.bseindia.com and also on the website of the Company i.e. www.grovel.com

The above results have been reviewed by the Audit Committee of the Directors and approved by the Board of Directors at their respective meetings held on 14th November, 2022.

For Texel Industries Limited
Sd/-
Shubhankh Mehta
Managing Director
DIN: 01457566

Place: Ahmedabad
Date: 14th November, 2022

BHATIA COMMUNICATIONS & RETAIL (INDIA) LIMITED
CIN: L32109GJ2008PLC053536
Regd. Off: 132, Dr. Ambedkar Shopping Centre, Ring Road, Surat-395002
Website: www.bhatiamobile.com, mail: info@bhatiamobile.com, Ph: 0261-2349892

Extract of Unaudited Financial Result for the Quarter ended 30th September, 2022

Sl. No.	Particulars	Amount in Lakh Except EPS				
		Quarter ended 30 th September 2022		Quarter ended 30 th September 2021		Quarter ended 30 th September 2022
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total Income from Operations	7354.875	14233.875	6879.000	6001.803	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	217.720	417.767	200.047	88.869	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	217.720	417.767	200.047	88.869	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	162.804	316.836	154.032	66.502	
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period after tax and Other Comprehensive Income (after tax))	163.549	318.325	154.777	67.547	
6	Paid-up Equity Share Capital (face value of Re.1/- each)	1251.520	1251.520	1251.520	1251.520	
7	Reserves (excluding Revaluation Reserve)	-	-	-	-	
8	Earnings Per Share (face value of Re.1/-each) (for continuing and discontinued operations)					
1	Basic	0.130	0.253	0.123	0.053	
2	Diluted	0.130	0.253	0.123	0.053	

* Reserves for the year ended March 31, 2022 was Rs. 3370.055 lakhs.

The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at www.bhatiamobile.com

The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 14th November, 2022

The limited review as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company.

Date: 14.11.2022
Place: Surat

For Bhatia Communications & Retail (India) Limited
Sd/-
Sanjeev Harbanlal Bhatia
Managing Director

SHUBHAM POLYSIN LIMITED
(CIN: L17120GJ2012PLC069319)
Registered Office: Block No. 748, Saket Industrial Estate, Near Kariyari Oil Mill, Jetpura, Bantarpura Road, Vill: Borisana, Taluka: Kadi, Dist: Mehsana - 382728 (Gujarat)
E-Mail Id: ankit@shubhamp.com Website: www.shubhampolysin.com

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH SEPTEMBER, 2022

Particulars	(Rs. In Lakhs)		
	Quarter ended on 30-09-2022 (Unaudited)	Cumulative upto 30-09-2022 (Unaudited)	Quarter ended on 30-09-2021 (Unaudited)
Total income from operations	1122.07	2478.97	1522.71
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items #)	55.74	61.89	11.72
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items #)	55.74	61.89	11.72
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items #)	50.70	47.82	3.34
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period after tax and Other Comprehensive Income (after tax))	50.70	47.82	3.34
Equity Share Capital	1102	1102	1102
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	-	-	-
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations - (a) Basic & (b) Diluted)	0.46	0.43	0.03

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other disclosure Requirements) Regulations, 2015.

The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com) and the website of the Company (www.parkergroup.com).

- Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules.

FOR SHUBHAM POLYSIN LIMITED
Sd/-
ANKIT ANIL SOMANI
MANAGING DIRECTOR (DIN: 05211800)

Place: Borisana
Date: 14th November, 2022

HDFC Housing Development Finance Corporation Ltd. POSSESSION NOTICE
Branch Address : HDFC House, Trident Complex, Race Course, Vadodra-390007. Tel. : 0265-6480799

Whereas the Authorized Officers of Housing Development Finance Corporation Limited, under Sanctioning and Authorization of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (1) (2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued under Section 13 (1) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amount due as mentioned against their respective names together with interest thereon at the applicable rate as mentioned in the said notices, within 03 days from the date of the said notices, incidental expenses, costs, charges etc. till the date of payment and/or realisation.

Sr. No.	Name of Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s)	Outstanding Dues Rs. As on Dt. *	Date of Demand Notice	Date of Possession Physical / Symbolic	Description of Immovable Property(ies) Secured Asset(s)
1	MR. RAJESH KRISHNAN NAIR (Borrower) 138656-610226093	Rs. 19,95,122/- As on 30-Apr, 2022	31-May, 2022	10-Nov, 2022	C-155, RADHE KRISHNA RESIDENCY, R. S. 4471, NR. RADHE PARK, NR. SAHAJANAND PARK, KAPODRA PATIA, VALLA ROAD, ANKLESHWAR-393002.
2	MR. BHAVIN BALUBHAI PATIL (Borrower) MR. BALABHAI RATANJIHAI PATEL (Co-Borrower) MR. JAGDISHHAI BALUBHAI PATIL (Borrower) 138657-610815000	Rs. 12,51,202/- As on 30-Apr, 2022	31-May, 2022	10-Nov, 2022	FLAT NO.-AA1-108, FIRST FLOOR, SHAYANA RESI. PLAZA-TYPE-AA1, R. S. 553, PLOT-1 TO 36, C. D., NR. AMBE GREEN CITY, NR. SWASTIK PARK SOC., KHASARVADI VALLA ROAD, ANKLESHWAR, BHARUCH-393002
3	MR. MOHANLAL KHETAJI PRAJAPATI (Borrower) MRS. KAMIDEVI MOHANLAL PRAJAPATI (Co-Borrower) 133220-624649930 & 613930968	Rs. 5,12,073/- And Rs. 4,97,555/- Respectively As on 30-Apr, 2022	31-May, 2022	10-Nov, 2022	FLAT-B-201, 2ND FLOOR, SURYA PALACE CHS, B.L.OCK-B, PLOT H-180, S. NO. 281P/282P NEAR SANSKRITIC FLOWERS, B/H 5003, GUJIC, ANKLESHWAR-393002.
4	MR. VIKAS PANNANLAL SHUKLA (Borrower) 142523-619136924 & 618441706	Rs. 15,670/- And Rs. 14,97,323/- Respectively As on 30-Apr, 2022	31-May, 2022	10-Nov, 2022	ROW HOUSE-B-13, SHI SHRADHA RESIDENCY, S. NO. 432B, BEHIND RADHEKRISHNA, NEAR AMBE GREEN CITY, KAPODRA PATIA, VALLA ROAD, ANKLESHWAR-393002.
5	MR. RAKESHKUMAR SINGH (Borrower) MRS. SAROJIDEVI RAKESHKUMAR SINGH (Co-Borrower) 142522-646263585 & 645445594	Rs. 89,091/- And Rs. 15,92,631/- Respectively As on 30-Apr, 2022	31-May, 2022	10-Nov, 2022	ROW HOUSE-1060, HAPPY RESIDENCY, R. S. 46, WAGH ROAD, CHAPARA PATIA, TO H. H. ROAD, ANDADA, ANKLESHWAR-393002.
6	MR. NAMAL KISHOR YADAV (Borrower) 138512-614423299	Rs. 9,53,115/- As on 28-Feb, 2022	22-Mar, 2022	10-Nov, 2022	B-30, ADITYA NAGAR SOCIETY, R. S. 2641, NR. D. S. NAGAR, WEST WELCOME NAGAR, GADKHOOL PATIA, ANKLESHWAR-393010.
7	MR. SANATKUMAR RAJARAM PANDEY (Borrower) 142531-606551901	Rs. 10,44,311/- As on 30-Apr, 2022	31-May, 2022	10-Nov, 2022	D-243, SUN CITY, R. S. NO. 541 TO 544, 546, 547, OPP. KUM KUM BUNGLOWS, VALLA ROAD, KOSAMDI, ANKLESHWAR-393002, GUJARAT.
8	MR. SANATKUMAR RAJARAM PANDEY (Borrower) MRS. KUSHUBHEN SANATKUMAR PANDEY (Co-Borrower) 143003-607389431	Rs. 6,65,317/- As on 30-Apr, 2022	31-May, 2022	10-Nov, 2022	FLAT NO.-8-G01, GROUND FLOOR, KRISHNA COMPLEX "B" TOWER, B/S KRISHNA PARK, KAPODRA ROAD, OPP. CHS, VALLA ROAD, ANDADA, ANKLESHWAR-393002.

* With further interest as applicable, incidental expenses, costs, charges etc. incurred till the date of payment and/or realisation.

However, since the borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned herein have failed to repay the amounts due, notice is hereby given to the borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned herein above in particular and to the public in general that the Authorized Officers of HDFC have taken Possession of the immovable property (ies) secured asset(s) described herein above in exercise of powers conferred on them under Section 13 (1) of the said Act, read with Rule 3 of the said Rules on the dates mentioned above.

The borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned herein above in particular and to the public in general are hereby cautioned to deal with the aforesaid Immovable Property(ies) / Secured Asset(s) and/or dealing with the said Immovable Property(ies) / Secured Asset(s) if he/she is subject to the Charge of Housing Development Finance Corporation Ltd. (Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is drawn to the provisions of sub-section (1) of section 13 of the said Act, in respect of time available to redeem the secured assets.

Notice of the Panditnamas drawn and hereby made is available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) is/are requested to collect the respective copy from the undersigned on any working day during normal office hours.

Date : 14-11-2022
Place : Vadodra

For, Housing Development Finance Corporation Ltd.
Sd/-
Authorised Officer
Regd. Office: Ramon House, H T Parekh Marg, 169, Backbay Reclamation, Churchgate, Mumbai- 400020
Corporate Identity Number : CIN: L71060MH1977PLC019916, E-mail : customer.service@hdfc.com, Website : www.hdfc.com

PUROHIT CONSTRUCTION LIMITED
CIN : L45200GJ1991PLC015878
REGD.OFFICE-401, PUROHIT HOUSE, OPP. STADIUM, NAVRANGPURA, AHMEDABAD-380 009
Telephone Number : 079-64264886, Email Id: cs@purohitconstruction.com
Website: www.purohitconstruction.com

Statement of Standalone unaudited Financial Results for the Quarter and Half Year Ended 30th September, 2022

Sl.No.	Particulars	(Rs. in Lakh except EPS)					
		Three Months ended		Half Year Ended		Year ended	
		30/09/2022	30/06/2022	30/09/2021	30/09/2021		
1	Total Income from Operations	20.00	20.00	20.00	20.00	21.21	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(21.20)	(21.20)	(21.20)	(21.20)	(21.64)	
3	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(21.20)	(21.20)	(21.20)	(21.20)	(21.64)	
4	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(21.20)	(21.20)	(21.20)	(21.20)	(21.64)	
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period after tax and Other Comprehensive Income (after tax))	(21.47)	(21.47)	(21.47)	(21.47)	(21.91)	
6	Equity Share Capital (Face Value of Rs. 10/- each)	36.96	36.96	36.96	36.96	36.96	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	
8	Earnings Per Share (Face Value of Rs. 10/- each) (for continuing and discontinued operations - (a) Basic & (b) Diluted)	(0.58)	(0.58)	(0.58)	(0.58)	(0.58)	

Notes :
1. The Above Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on 14.11.2022
2. The above result for the quarter and half year ended on 30.09.2022 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules 2015 (Ind AS), prescribed under section 133 of the Companies Act 2013 and other relevant accounting practices and policies to the extent applicable.
3. The Limited Review of Unaudited Financial Results for the Quarter and Half Year ended September, 30, 2022 as required in terms of Clause 33 of SEBI (LODR) Regulations, 2015 has been carried out by Statutory Auditors.
4. The Figures pertaining to previous periods have been regrouped, reclassified and restated wherever necessary.
5. The above financial results are available on the Company's website www.purohitconstruction.com and also on the website of BSE (www.bseindia.com)

For and on behalf of the Board of Directors
NARENDRA M. PUROHIT
(Chairman & Managing Director)
DIN:00755195

Place : Ahmedabad
Date : 14/11/2022

AKASHI INFRA-PROJECTS LIMITED
Registered Office: C-8000 FLOOR, AMBEJEE COMPLEX, OPP. HOTEL NAVELI, ROAD-11 GANDHINAGAR-380011
CIN: L45200GJ99991026003, Ph: No. +91-79-23227606, Fax: +91-79-23231004
Website: www.akashiinfra.com, E-Mail: info@akashiinfra.com

Extract of Statement of Standalone and Consolidated Un-Audited Financial Results for the quarter and half year ended on 30.09.2022

Sr.No.	Particulars	(Rs. in Lakhs Except per Share Data)											
		Standalone						Consolidated					
		Quarter ended		Half year ended		Year ended		Quarter ended		Half year ended		Year ended	
1	Total Income	560.93	1480.28	1480.28	1480.28	1480.28	560.93	1480.28	1480.28	1480.28	1480.28	1480.28	
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	56.31	295.37	134.56	345.84	246.31	56.31	295.37	134.56	345.84	246.31	345.84	
3	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	19.72	98.34	51.57	117.98	112.09	19.72	98.34	51.57	117.98	112.09	117.98	
4	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	56.31	295.37	134.56	345.84	246.31	56.31	295.37	134.56	345.84	246.31	345.84	
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period after tax and Other Comprehensive Income (after tax))	1,696.25	1,696.25	1,696.25	1,696.25	1,696.25	1,696.25	1,696.25	1,696.25	1,696.25	1,696.25	1,696.25	
6	Equity Share Capital (Face Value of Rs. 10/- each)	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	0.12	0.48	0.24	0.66	0.52	0.12	0.48	0.24	0.66	0.52	0.50	
8	Earnings Per Equity Share (Not Annualized)/Basic	0.12	0.48	0.24	0.66	0.52	0.12	0.48	0.24	0.66	0.52	0.50	

Notes:
1. The above is an extract of the detailed format of Un-Audited Financial Results for the Quarter and Half Year ended on 30.09.2022 filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the aforesaid Quarter are available on the Stock Exchange websites i.e. www.bseindia.com and on the website of the Company i.e. www.akashiinfra.com.
2. The above results have been reviewed by the Audit Committee of the Director and approved by the Board of Directors at their meeting held on November 12, 2022.

FOR AKASHI INFRA PROJECTS LIMITED
Sd/-
ANURAG P. GOLI
MANAGING DIRECTOR
DIN: 06663170

Place: Gandhinagar
Date: November 13, 2022

